



# Shree Rama Multi-Tech Limited

An ISO 9001 : 2015 Certified Company



18, CORPORATE HOUSE, OPP. DINESH MALL, NAVRANGPURA, AHMEDABAD-380009

**REGD OFFICE:** ~~301, CORPORATE HOUSE, OPP. TORRENT HOUSE, INCOME TAX, AHMEDABAD-380009.~~

TELE : (079) 27546800, 27546900 EMAIL : cslegal@srmtl.com WEBSITE : www.srmtl.com CIN NO : L25200GJ1993PLC020880

March 24, 2023

To,  
**BSE Limited**  
The Listing Department  
Phiroje Jeejeebhoy Towers  
Dalal Street, Mumbai - 400 001,  
Maharashtra, India.

**National Stock Exchange of India Limited**  
Manager - Listing Compliance  
'Exchange Plaza'. C-1, Block G,  
Bandra Kurla Complex, Bandra (E),  
Mumbai - 400 051

Symbol: SHREERAMA  
Scrip Id: 532310

Symbol: SHREERAMA

Dear Sir / Madam,

**Ref.: Proposed Rights Issue of Equity Shares of Shree Rama Multi-Tech Limited (the "Company").**

**Sub.: Filing of advertisement pursuant to the provisions of the Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015**

Pursuant to provisions of Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are submitting herewith the copy of Public Announcement published in connection with the Rights Issue of the Company in terms of Regulation 72(2) of the SEBI (Issue of Capital and Disclosure Requirements) Regulations, 2018 in the following newspapers on March 24, 2023:

1. Financial Express - (English) National Daily – All Editions.
2. Jansatta - (Hindi) National Daily – All Editions.
3. Financial Express - (Gujarati) Regional Language – Ahmedabad Edition.


Kindly take the same on record and disseminate.

Thanking You,

Yours Faithfully,

For, Shree Rama Multi-Tech Limited

Sandip Mistry  
Company Secretary and Compliance Office



Encl.: As Above

All Contractual obligation subject to Ahmedabad Jurisdiction.

**Lami-Tubes, Tube Laminates, Flexible Packaging, Seamless Tubes.**

MEETING ON MARCH 28

# Vedanta board to consider fifth interim dividend


FE BUREAU  
New Delhi, March 23

VEDANTA LTD ON Thursday said its board would meet on March 28 to consider and approve the fifth interim dividend on equity shares, if any, for financial year 2022-23.

The move is yet another indication of the predicament that promoter Anil Agarwal finds himself in as he attempts to deleverage his commodities business at a time when interest rates are on the rise.



Anil Agarwal



Agarwal is banking on dividend payouts to repay loans after the Indian government opposed his plan to sell the group's international zinc operations to Hindustan Zinc for close to \$3 billion.

While companies are known to announce one or at best two interim dividends and one final dividend, Agarwal seems to be making a habit of paying interim dividends.

Vedanta had earlier announced an interim dividend of ₹12.50 per share in February (ex-date), ₹17.50 in November, ₹19.50 in July, and ₹31.50 in April.

Investors in Agarwal's companies are anxious about the high level of borrowings. Vedanta Resources has pared its net debt by \$2 billion

this year, and said in a regulatory filing in February, that it would continue to pay off loans worth \$7.7 billion over the next two years.

Meanwhile, the stock price of Vedanta Ltd fell 4.87% to ₹271.35 apiece on Thursday on the BSE on the back of media reports that the promoters were looking to sell a stake in the company.

Bloomberg recently reported Vedanta Resources, which owns about 70% of Vedanta, has been in talks with at least three banks for a loan of as much as \$1 billion.

Earlier this month, the board of Hindustan Zinc, part of the Vedanta group promoted by Agarwal, approved its fourth interim dividend for FY23 at ₹26 per share, which will see an outflow of nearly ₹11,000 crore from the company.

Agarwal's Vedanta owns about 65% of Hindustan Zinc, while the Indian government has a stake of close to 30%.

# Uneven growth of auto, tractor segments likely in next fiscal

SWARAJ BAGGONKAR  
Mumbai, March 23

PRODUCTION CONSTRAINTS, CHIP availability issues, El Nino, expensive auto loans, product price hikes and general inflation are expected to keep growth under check for the automotive and tractor segments in the next financial year even as they close FY23 with record volumes.

The high base of the current year will also make the FY24 growth numbers look muted. However, as next year is also a pre-election year, market watchers are predicting growth for specific segments like two-wheelers, though it may not be a pan-India growth.

Speaking to *FE*, Shashank Srivastava, senior executive officer, marketing and sales, Maruti Suzuki India, said, "Some red flags might hit demand in FY24. El Nino would affect rural demand and buyer sentiment. Auto loan rates have gone up 180-250 basis points. Consumers will also respond to price hikes by manufacturers."

In rural markets, passenger

## Maruti to hike prices to pass on input cost pressures

MARUTI SUZUKI INDIA said on Thursday it would raise prices across models come April, as high domestic inflation and new emission norms pressure the country's top carmaker. It did not say how much prices of cars would go up by, or which models will be impacted.

Maruti joins rival Tata

Motors and two-wheeler firm Hero Motocorp, which has also said they would raise prices by 5% and 2%, respectively. India plans to implement Bharat Stage VI norms from April, which require automakers to fit their vehicles with a special device to monitor emissions, leading to extra costs.

FY22)," Srivastava added.

Tata Motors admitted to Nomura about the stress on demand which has started to reflect in the PV segment, depicted by rising inventories at the dealer's end. It will also be constrained on capacity since its new capacity will likely come on stream only a year later.

About 10% of the planned output by Maruti was lost to semiconductor shortage. In the December quarter, its lost production of 46,000-47,000 cars due to the shortage. "The chip

shortage impact continues. It appears that March (output) loss will be much higher than January and February. The problem will persist in a few more quarters," Srivastava added.

Mahindra & Mahindra and Hyundai, the other two big carmakers, are also operating at peak capacity and will be supply constrained in FY24.

However, with general elections due to be held in FY25, the Centre is expected to push for some mega projects, especially targeting the infrastructure and agri sectors. This is expected to bring some respite from the El Nino crisis, say market experts.

Yogesh Mathur, operating officer - sales and marketing, Honda Motorcycle and Scooter India, said, "In Uttar Pradesh, 100 cc has a share of 60% and the state is seeing significant spending in the infrastructure segment. Likewise, the government's spending at the national level is also going to be very good. This would augur well for budget two-wheeler models."

Crisil sees domestic tractor sales volumes growth halving to 4-6% in FY24 from a high base.

# Mercedes-Benz to drive in 4 new EVs

VIKRAM CHAUDHARY  
New Delhi, March 23



GERMAN LUXURY CAR-MAKER Mercedes-Benz India wants 25% of its India sales to come from electric cars in the next four years (by 2027), and for that it will launch four all-new EV models in 8-12 months, a top global executive of the company told *FE*.

"Having 25% of sales in India coming from EVs by 2027 is a realistic target," Matthias Lührs, head of region overseas, Mercedes-Benz Cars, said. "To meet that target, we will need new models and four of those will be launched within 8-12 months from today."

Mercedes-Benz India is the frontrunner in the luxury EV space — it launched the EQC in October 2020, followed by EQS AMG in August 2022, EQS in September 2022 and EQB in December 2022. Of these, the EQS (priced ₹1.55 crore, ex-showroom), is assembled in India; all others are CBU (completely built unit) imports.

Lührs — who heads Asia (minus China), APAC, ANZ, LatAm, Africa and select European markets including Scandi-

navia — however, didn't share which models will be launched in India, and whether or not these will be locally assembled.

Santosh Iyer, MD & CEO, Mercedes-Benz India, said the carmaker is by far the leader in the luxury EV space. Though he didn't share how many EVs it has sold in India, he said: "Our EV par — the cumulative EVs we have sold in India since the EQC was launched — will soon cross 1,000 units."

Mercedes-Benz has a global goal of going all-electric by 2030-32, and Lührs said 2027 onwards in India too, the luxury EV space for it could grow in geometric progression instead of arithmetic. "We may take 6-7 years to go from 0% to 25% EV sales share (2020 to 2027), but we could grow from 25% to 50% by even 2029, faster after that," he said.

# ONDC expands into mobility, onboards auto booking app

TUSHAR GOENKA  
Bengaluru, March 23

THE OPEN NETWORK for Digital Commerce (ONDC) on Thursday forayed into mobility by onboarding Namma Yatri, a Bengaluru-based auto-rickshaw booking app. The latest move by the government's not-for-profit e-commerce platform is aimed at helping small businesses fight the dominance of giants like Ola and Uber, which have been accused of increasing take rates over years.

In its initial days, Namma Yatri, the technology of which was built and launched by Juspay Technologies, a payment infrastructure startup backed by Soft-Bank and Accel, will have a 0% commission model, sharply lower than the around 20% that ride-hailing companies like Ola and Uber currently charge. But in the next couple of months, the auto drivers' app will roll out a subscription model where drivers would be required to pay a certain subscription fee either per trip or per day to Juspay for the software upkeep. The company, however, said that the fees would be lower than the price of a "cup of coffee", and nowhere close to what large players like Ola and Uber charge currently.

While the service is currently available only in Bengaluru, with ONDC's help Namma Yatri plans to expand the offerings to multiple cities in the coming months. The portal will also get a further boost from the millions of users that Paytm and Snapdeal bring after their integration with ONDC. While Namma Yatri is a relatively new app, it has already onboarded over 45,000 drivers out of the total 150,000 auto drivers in the city. Vimal Kumar, CEO and founder of Juspay, said the app is adding about 200-300 drivers each day.

Months. The portal will also get a further boost from the millions of users that Paytm and Snapdeal bring after their integration with ONDC. While Namma Yatri is a relatively new app, it has already onboarded over 45,000 drivers out of the total 150,000 auto drivers in the city. Vimal Kumar, CEO and founder of Juspay, said the app is adding about 200-300 drivers each day.

Thanks to its growing base, Namma Yatri is doing over 15,000 daily rides with an average trip fare of ₹165. With the expansion into mobility, over and above food and grocery, fashion and other categories, "now, one can shop groceries on ONDC in the afternoon and then book an auto to go out with the family in the evening," T Koshy, CEO, ONDC, said.

The network is already in talks with several other transport operators on a national level to make ONDC a multi-modal transport operator, including train journeys, bus ticketing and cab bookings, among others, he added.

Ahmedabad

### IDBI Asset Management Limited

CIN: U65100MH2010PLC199319

Registered Office: IDBI Tower, WTC Complex, Cuffe Parade, Colaba, Mumbai - 400005  
Corporate Office: 4th Floor, IDBI Tower, WTC Complex, Cuffe Parade, Colaba, Mumbai - 400005  
Tel: (022) 66442800 Fax: (022) 66442801 Website: www.idbimutual.co.in E-mail: contactus@idbimutual.co.in

**Notice No. 08/2022-23**

#### Winding up of IDBI Gilt Fund and IDBI Dynamic Bond Fund, Under Regulation 39(2)(c) of SEBI (Mutual Funds) Regulations, 1996

This is with reference to the Notice No. 05/2022-23 dated October 29, 2022 for the Winding up of IDBI Gilt Fund and IDBI Dynamic Bond Fund, Under Regulation 39(2)(a) of SEBI (Mutual Funds) Regulations, 1996 (Regulations).

The winding up of the schemes were carried out successfully under Regulation 39(2)(c) of Regulations instead of Regulation 39(2)(a) of Regulations. Accordingly, all the provisions of Regulation 39(2)(c) of Regulations were followed to wind up the schemes.

In this regard, investors are requested to note that we hereby revise the above mentioned notice as follows. NOTICE is hereby given that pursuant to compliance of Regulation 39(2)(c) of SEBI (Mutual Funds) Regulations, 1996 and SEBI Circular CIR/IMD/DF 15/2014 dated June 20, 2014, IDBI MF Trustee Company Limited ("Trustee" of IDBI Mutual Fund) has decided to wind up IDBI Gilt Fund (An open-ended debt scheme investing in government securities across maturities. A relatively high interest rate risk and relatively low credit risk scheme) and IDBI Dynamic Bond Fund (An open ended dynamic debt scheme investing across duration. A relatively high interest rate risk and relatively low credit risk scheme) (hereinafter "the Schemes") as the Schemes were not able to maintain Asset Under Management (the AUM) of Rs. 20 crores on rolling basis.

All the open ended debt schemes were required to maintain average AUM of Rs.20 crores on half yearly rolling basis. However, in case of IDBI Dynamic Bond Fund the Half-yearly rolling average was reduced below Rs. 20 Crores on 17th July 2022 and continued to remain below the required limit. Similarly, the Half-yearly rolling average of IDBI GILT Fund was reduced below Rs. 20 Crores on 12th May 2022 and continued to remain below the limit.

In view of difficulty in scaling up the Average AUM above the threshold limit and for the compliance with the above mentioned circular it was decided to wind up both the schemes.

For IDBI Asset Management Limited (Investment Manager to IDBI Mutual Fund) Sd/-  
Chief Compliance Officer

Place : Mumbai Date : March 23, 2023

**Statutory Details:** IDBI Mutual Fund has been set up as a trust sponsored by IDBI Bank Limited with IDBI MF Trustee Company Limited as the Trustee ("Trustee" under the Indian Trusts Act, 1882) and with IDBI Asset Management Limited as the Investment Manager.

**Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.**

### PUBLIC ANNOUNCEMENT

(This is a public announcement for information purposes only and is not an offer document and does not constitute an invitation or offer to acquire, purchase or subscribe to securities. Not for release, publication or distribution directly or indirectly outside India.)

## SHREE RAMA MULTI-TECH LIMITED

Corporate Identification Number: L25200GJ1993PLC020880

Our Company was incorporated as "Shree Rama Multi-Tech Limited" on December 17, 1993, as a public limited company under the Companies Act, 1956, pursuant to a certificate of incorporation issued by the Registrar of Companies, Gujarat, Dadra & Nagar Haveli ("RoC") upon conversion of a partnership firm named "M/s Shree Rama Multi Tech". Our Company received its certificate of commencement of business dated January 11, 1994 from the RoC. For details of change in the address of the registered office of our Company, see "General Information" on page 41 of the Draft Letter of Offer dated March 22, 2023 ("DLoF").

Registered Office: 18, Corporate House, Opp. Dinesh Hall, Navrangpura, Ahmedabad - 380 009, Gujarat, India  
Telephone: +91 79 2754 6800/900 | Email: cslegal@srmtl.com  
Contact Person: Sandip Mistry, Company Secretary and Compliance Officer  
Email: cslegal@srmtl.com | Website: www.srmtl.com

**OUR PROMOTERS: NIRMA CHEMICAL WORKS PRIVATE LIMITED AND NIRMA INDUSTRIES PRIVATE LIMITED**

**ISSUE OF UP TO [●] EQUITY SHARES WITH A FACE VALUE OF ₹ 5 EACH ("RIGHTS EQUITY SHARES") OF SHREE RAMA MULTI-TECH LIMITED (THE "COMPANY" OR THE "ISSUER") FOR CASH AT A PRICE OF ₹ [●] EACH INCLUDING A SHARE PREMIUM OF ₹ [●] PER RIGHTS EQUITY SHARE ("ISSUE PRICE") FOR AN AGGREGATE AMOUNT UPTO ₹ 7,50,00,00,000 ON A RIGHTS BASIS TO THE ELIGIBLE EQUITY SHAREHOLDERS OF OUR COMPANY IN THE RATIO OF [●] RIGHTS EQUITY SHARES(S) FOR EVERY [●] FULLY PAID-UP EQUITY SHARE(S) HELD BY THE ELIGIBLE EQUITY SHAREHOLDERS ON THE RECORD DATE, THAT IS ON [●] (THE "ISSUE"). THE ISSUE PRICE FOR THE RIGHTS EQUITY SHARES IS [●] TIMES THE FACE VALUE OF THE EQUITY SHARES. FOR FURTHER DETAILS, SEE "TERMS OF THE ISSUE" ON PAGE 187 OF THE DRAFT LETTER OF OFFER.**

This public announcement is being made pursuant to Regulation 72(2) of the Securities and Exchange Board of India (Issue of Capital and Disclosure Requirements) Regulations, 2018 as amended (the "SEBI ICDR Regulations"), to inform the public that our Company is proposing, subject to receipt of requisite approvals, market conditions and other considerations, an issue of Equity Shares to eligible equity shareholders on rights basis.

Pursuant to Regulation 72(1) of the SEBI ICDR Regulations, the Company has filed the DLoF with Securities and Exchange Board of India ("SEBI"), BSE Limited ("BSE") and National Stock Exchange of India Limited ("NSE") ("BSE" and "NSE", collectively, referred as "Stock Exchanges") on March 23, 2023 and is open to public for comments, if any, for a period of 21 (twenty one) days from the date of such filing. The DLoF is hosted on the website of the SEBI www.sebi.gov.in, website of designated stock exchange, i.e., BSE at www.bseindia.com, website of NSE at www.nseindia.com, and website of the Lead Manager i.e. Vivro Financial Services Private Limited at www.vivro.net. We invite the public to give comments on the DLoF filed with the SEBI. The public are requested to send a copy of their comments to SEBI, the Company Secretary and Compliance Officer and/or the Lead Manager at their respective addresses on or before 5.00 p.m. on the 21st day from the date of filing the DLoF with the SEBI.

Investment in equity and equity related securities involve a degree of risk and investors should not invest any funds in this issue unless they can afford to take the risk with such investment. Investors are advised to read the risk factors carefully before taking an investment decision in this issue. For taking an investment decision, investors must rely on their own examination of our Company and the Issue including the risks involved. The Rights Equity Shares have not been recommended or approved by the SEBI nor does SEBI guarantee the accuracy or adequacy of the contents of this DLoF. Specific attention of investors is invited to the statement of "Risk Factors" on page 18 of the DLoF.

For details of the share capital and capital structure of the Company, see "Capital Structure" on page 46 of the DLoF. The liability of the members of the Company is limited.

The existing Equity Shares are listed on the BSE and the NSE.

**Note:** Capitalized terms used herein and not specifically defined shall have the same meaning as ascribed to them in the DLoF.

LEAD MANAGER TO THE ISSUE	REGISTRAR TO THE ISSUE
<b>VIVRO</b> Vivro Financial Services Private Limited Vivro House, 11, Shashi Colony, Opposite Suviddha Shopping Centre, Paldi, Ahmedabad - 380 007, Gujarat, India. Telephone: +91 79 4040 4242 E-mail: investors@vivro.net Website: www.vivro.net Investor grievance E-mail: investors@vivro.net Contact Person: Samir Santara / Kruti Saraiya SEBI Registration No.: INM000010122	<b>KFINTECH</b> KFin Technologies Limited (Formerly known as KFin Technologies Private Limited) Selenium Tower - B, Plot 31 & 32, Gachibowli, Financial District, Nanakramguda, Serilingampally, Hyderabad 500 032, Telangana, India. Telephone: +91 40 6716 2222 E-mail: srmtl.rights@kfin.tech.com Website: www.kfintech.com Investor grievance E-mail: einward.ris@kfintech.com Contact Person: M. Murali Krishna SEBI Registration No.: INR000000221

For and on behalf of  
**SHREE RAMA MULTI-TECH LIMITED**  
Sd/-  
Sandip Mistry  
Company Secretary and Compliance Officer

Place: Ahmedabad  
Date: March 23, 2023

**Disclaimer:** Shree Rama Multi-Tech Limited is proposing, subject to receipt of requisite approvals, market conditions and other considerations, a rights issue of its equity shares and has filed a DLoF with SEBI. The DLoF is available on the websites of SEBI and Vivro Financial Services Private Limited at www.sebi.gov.in and www.vivro.net, respectively. Investors should note that investment in equity shares involves a high degree of risk and for details refer to the DLoF, including the section titled "Risk Factors" on page 18 of the DLoF. Raka

## SOTAC PHARMACEUTICALS LIMITED

Corporate Identification Number: U24230GJ2015PLC085451  
Website: www.sotapharma.com; • E-Mail: compliance@sotapharma.com; • Telephone No: +91 90819 93300;  
Company Secretary and Compliance Officer: Ms. Pooja Bagrecha

PROMOTERS OF OUR COMPANY: MR. SHARADKUMAR DASHRATHBHAI PATEL, MR. DINESHKUMAR BABULJI GELOT, MR. VISHALKUMAR DEVRAJBHAI PATEL, MR. CHETANKUMAR BACHUBHAI PATEL AND MRS. KIRAN BALDEVBHAI JOTANIA

**CORRIGENDUM TO ADVERTISEMENTS**

Our company had issued Price Band and Issue Opening Advertisements in Financial Express (All Edition) Gujarati and English Newspapers and Jansatta (All Edition) Hindi Newspapers on March 23, 2023. In both the Advertisements, Section titled "The Issue" should be read as below.

**THE ISSUE**

INITIAL PUBLIC ISSUE OF 300000 EQUITY SHARES OF FACE VALUE OF ₹ 10/- EACH OF SOTAC PHARMACEUTICALS LIMITED ("SPL" OR THE "COMPANY" OR THE "ISSUER") FOR CASH AT A PRICE OF ₹ [●] / PER EQUITY SHARE INCLUDING A SHARE PREMIUM OF ₹ [●] / PER EQUITY SHARE (THE "ISSUE PRICE") AGGREGATING TO ₹ [●] LAKHS ("THE ISSUE"), OF WHICH 150000 EQUITY SHARES OF FACE VALUE OF ₹ 10/- EACH FOR CASH AT A PRICE OF ₹ [●] / PER EQUITY SHARE INCLUDING A SHARE PREMIUM OF ₹ [●] / PER EQUITY SHARE AGGREGATING TO ₹ [●] LAKHS WILL BE RESERVED FOR SUBSCRIPTION BY MARKET MAKER TO THE ISSUE (THE "MARKET MAKER RESERVATION PORTION"). THE ISSUE LESS THE MARKET MAKER RESERVATION PORTION I.E. NET ISSUE OF 250000 EQUITY SHARES OF FACE VALUE OF ₹ 10/- EACH AT A PRICE OF ₹ [●] / PER EQUITY SHARE INCLUDING A SHARE PREMIUM OF ₹ [●] / PER EQUITY SHARE AGGREGATING TO ₹ [●] LAKHS IS HEREIN AFTER REFERRED TO AS THE "NET ISSUE". THE ISSUE AND THE NET ISSUE WILL CONSTITUTE 27.15% AND 25.79%, RESPECTIVELY, OF THE POST ISSUE PAID UP EQUITY SHARE CAPITAL OF OUR COMPANY.

All capitalized terms used herein and not specifically defined shall have the same meaning as ascribed to them in the Red Herring Prospectus.

On behalf of Board of Directors  
For, Sotac Pharmaceuticals Limited  
Sd/-  
Mr. Sharadkumar Dashrathbhai Patel  
Chairman and Managing Director

Place: Ahmedabad  
Date: March 23, 2023

**Disclaimer:** Sotac Pharmaceuticals Limited is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial public offer of its Equity Shares and has filed the RHP with the Registrar of Companies, Ahmedabad on March 21, 2023 and thereafter with SEBI and the Stock Exchanges. The RHP is available on the websites of SEBI at www.sebi.gov.in, website of the Company at www.sotapharma.com, the website of the BRLM to the issue at www.beelinebm.com, the website of NSE i.e., www.nseindia.com, respectively. Any potential investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to the same, please refer to the RHP including the section titled "Risk Factors" beginning on page 42 of Red Herring Prospectus.

## FINO PAYMENTS BANK LIMITED

Registered Office: Mindspace Juinagar, 8th Floor, Plot No. Gen 2/1/F, Tower 1, TTC Industrial Area, MIDC Shirwane, Juinagar, Navi Mumbai, Thane - 400706. CIN: L65100MH2007PLC171959; E-mail: cs@fिनo.bank.com  
Website: www.fिनo.bank.com; Phone: +91 22 7104 7000

**NOTICE OF POSTAL BALLOT**

NOTICE is hereby given pursuant to the provisions of Section 110 read with Section 108 and other applicable provisions, if any, of the Companies Act, 2013 ("Act") read with Rule 20 and Rule 22 of the Companies (Management and Administration) Rules, 2014 ("Rules") (including any statutory modification or re-enactment thereof for the time being in force), Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations"), Secretarial Standard on General Meetings issued by the Institute of the Company Secretaries of India ("SS-2") and the guidelines prescribed by the Ministry of Corporate Affairs, Government of India General Circular Nos. 14/2020 dated April 8, 2020, 17/2020 dated April 13, 2020, 22/2020 dated June 15, 2020, 33/2020 dated September 28, 2020, 39/2020 dated December 31, 2020, 10/2021 dated June 23, 2021, 20/2021 dated December 8, 2021, 3/2022 dated May 5, 2022 and 11/2022 dated December 28, 2022 (the "MCA Circulars") and other applicable laws, rules, regulations, if any, that Fino Payments Bank Limited ("Bank") seeks approval of the members of the Bank by way of a Special Resolution to approve the remuneration of Mr. Rishi Gupta, Managing Director & CEO ("M.D. & CEO") of the Bank for the financial year 2021-22, through Postal Ballot.

Members are informed that the Bank has on March 23, 2023, completed the dispatch of the Postal Ballot Notice dated March 11, 2023 to those members of the Bank whose name appear in the list of Register of Members/Register of Beneficial Owners maintained by the Depositories viz., National Securities Depository Limited ("NSDL") and Central Depository Services (India) Limited ("CDSL") as on Friday, March 17, 2023 ("cut-off date") for the purpose, in electronic form to those members whose email address are registered, with the Registrar and Share Transfer Agent of the Bank, KFin Technologies Limited ("RTA") or Depositories or Depository Participants. A person who is not a Member as on cut-off date should treat the Postal Ballot Notice for information purpose only.

The Postal Ballot Notice along with the Explanatory Statement and remote e-voting instructions are available on the Bank's website at www.fिनo.bank.com, websites of the respective Stock Exchanges viz. BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com and also on the e-voting website of NSDL at https://www.evoting.nsdl.com/.

The members of the Bank whose name appear in the list of Register of Members/Register of Beneficial Owners maintained by NSDL and CDSL as on cut-off date shall be entitled to vote in relation to the resolution specified in the Postal Ballot Notice. The Bank has appointed NSDL for facilitating e-voting to enable the members to cast their votes electronically. The detailed procedure/instructions on remote e-voting including the manner in which the members who have not yet registered their e-mail addresses can register their email address and/or can cast their vote as specified in the Postal Ballot Notice. The voting rights of the members shall be in proportion to their share in the paid-up equity share capital of the Bank as on the Cut-Off Date.

The e-voting facility will be available during the following voting period:

Commencement of e-voting	End of e-voting
Friday, March 24, 2023 at 9:00 a.m. (IST)	Saturday, April 22, 2023 at 5:00 p.m. (IST)

The remote e-voting shall not be allowed beyond the said date and time. The remote e-voting module shall be disabled for voting thereafter. Once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently.

The Board of Directors has appointed Mr. Tribhuvaneshwar Kaushik and in his absence, Mr. Savayaschi Joshi of M/s. Kaushik Joshi & Co, Practising Company Secretaries, as the Scrutinizer to scrutinize the postal ballot process in a fair and transparent manner.

The Scrutinizer will submit his report to the Chairman or Company Secretary as authorized by the Board of Directors of the Bank. The results of the Postal Ballot will be announced on or before Tuesday, April 25, 2023. The results, along with the Scrutinizer's Report will be hosted at the Bank's website viz. www.fिनo.bank.com and on the e-voting website of NSDL at https://www.evoting.nsdl.com/ and also be communicated simultaneously to the respective Stock Exchanges viz. BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com where the equity shares of the Bank are listed. Additionally, the results will also be placed on the notice board at the Registered Office of the Bank.

In case of any queries/issues or grievances you may refer the Frequently Asked Questions (FAQs) for members and e-voting user manual for members available at the download section of http://www.evoting.nsdl.com/ or call on toll free no.: 1800 1020 990 and 1800 22 44 30 or send a request to Mr. Sanjeev Yadav, Assistant Manager, NSDL, Trade World, 'A' Wing, 4th Floor, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai 400 013 at evoting@nsdl.co.in

For Fino Payments Bank Limited  
Sd/-  
Basavraj Loni  
Company Secretary & Compliance Officer  
Membership No: A23095

Place: Navi Mumbai  
Date: March 23, 2023

**केन्द्रीय भंडारण निगम**  
(भारत सरकार का उपक्रम)  
अगरा क्रान्ति मार्ग, होज खाल, नई दिल्ली-110016, फोन: 011-26566107  
जान-जन के लिए घबराएं ना  
नो. सीबीसीसीसीसीसी/ईडीडीसीसी/6/2023-टैंकर सेल, सीबी

**निविदा आमंत्रण सूचना**  
केन्द्रीय भंडारण निगम (सीबीआईसीसीसी) "गैरनेटेड ई-मार्केटप्लेस (GeM) विड संख्या GEM/2023/B/3294207 के माध्यम से 03 बीएलएसएसएस-का निमाण और आपूर्ति (12 बीएलएसएसएस-ए वैन, 132 बीएलएसएसएस-बी धोवन और 03 ड्रक वैन)" हेतु विड आमंत्रित करता है। अधिक जानकारी एवं टैंडर अनुसूची देखने के लिए [www.geem.gov.in](http://www.geem.gov.in) देखी जा सकती है। GeM पर निधारी प्रारूप में ई-बिड जमा करने की अंतिम तिथि 18.04.2023 को 1500 बजे तक है।  
टैंडर सेल, निगमित कार्यालय,  
केन्द्रीय भंडारण निगम, नई दिल्ली।

**नशाल फाटलाइजर्स लिमिटेड**  
(भारत सरकार का उपक्रम)  
ए-11, सेक्टर-24, नोएडा-201 301  
(CIN-L74899DL1974G0107417)  
फोन नं.-0120-2412294, एक्सटेंशन-2220

संदर्भ संख्या एनएफएन/ईएट/एनपीआइए/पीके/2023-24/01 दिनांक: 24-03-2023  
ई-निविदा सं- 2023, एनएफएन 149869\_1

**वेरिफाई ई-बोली आमंत्रित करने के लिये नोटिस**  
चीन, इंडोनेशिया, जापान, मोरक्को, रूस, दक्षिण कोरिया और सऊदी अरब से लोड किये जाने वाले पी, ईओ के उर्वरक के निरीक्षण के लिये लोड पोर्ट निरीक्षण एजेंसियों के साथ पूर्व-अर्हता सह वार्षिक दर अनुबंध के लिये बोली आमंत्रित की जाती है।  
अधिक जानकारी के लिये, वेबसाइट: [www.nationalfertilizers.com](http://www.nationalfertilizers.com) या <https://etenders.gov.in/eprocure/app> देखें। यदि कोई शुद्धिपत्र/परिशिष्ट हुए तो केवल उपरोक्त वेबसाइट पर ही प्रकाशित किया जाएगा।  
कार्यकारी निदेशक (विपणन)  
@NFI\_Kisan @nationalfertilizers National Fertilizers Limited

**Criminal Courts Ladhiana**  
In The Court Of Ms. Shweta Dass  
JMJC Ladhiana COMA/1419/2020  
CNR NO: PBLD.003.005209-2020  
Pesh: 11-04-2023

publication notice for proclamation under section 82 CR.PC compliance R/w sec- 138 of N.I.Act  
Kotak Mahindra Bank Vs. Bindra Travel Line Pvt. Ltd.  
Publication Issued To: Bindra Travel Line Pvt. Ltd Through its Authorised Signatory Amandeep Singh Bindra R/o Shop No 3, gurau namak market op chest hospital moji nagar new delhi-110015, amandeep.singh bindra s/o not known r/o 6 45-4-walid purjabi bagh, new delhi 110026 bindrajpr Singh bindra s/o not known r/o shop no 3 gurau namak market op chest hospital moji nagar, new delhi 110015 Whereas it has been proved to the satisfaction of this court that you, the accused above named cannot be served in the ordinary way of service. Hence this proclamation under section 82 CR.PC is hereby issued against you with a direction that you should appear personally before this court on 11.4.2023 at 10.00 a.m. or within 30 days from the date of publication of this proclamation. Take notice that, in default of your part to appear as directed above, the above said case will be heard and determined as per law, in your absence. For details logon to: [https://highcourtchd.gov.in/ltrsdistrict\\_notice&district=Ladhiana](https://highcourtchd.gov.in/ltrsdistrict_notice&district=Ladhiana) JMJC Ladhiana

**यूको बैंक**  
(भारत सरकार का उपक्रम)

परिमर्शित प्रबंध शाखा-5, संसद मार्ग, नई दिल्ली-110001, फोन: 011-23753278

संदर्भ सं. एनडी/एमएमबी/2022-23/208 दिनांक: 21.03.2023

**गारंट:**  
1. श्री जय शंकर श्रीवासव  
2. श्री जगमोहन गान्  
3. श्री मनोज कुमार सिंह  
4. श्री कुंवर देवेन्द्र सिंह  
5. श्री मयंक कुमार

अचल सम्पत्ति (तिरों) की बिना के लिये विक्री सूचना

**UCO BANK**  
(A Govt. of India Undertaking)  
Honourable Your Trust

संपत्ति का विवरण

आवंशित मूल्य

धाराएं गांधी

खता नं. 29, खसरा नं. 636, 637, 638, ग्राम-छजारासी, कुलीचनगर, परगणा-डासन, हापुड़, उ.प्र., प्लॉट परिया माप 519 वर्ग मी. में इंस्टीट्यूशनल सम्पत्ति

रु. 30.00 लाख

रु. 3.00 लाख

खता नं. 29, खसरा नं. 636, 637, 638, ग्राम-छजारासी, कुलीचनगर, परगणा-डासन, हापुड़, उ.प्र., प्लॉट परिया माप 1038 वर्ग मी. में इंस्टीट्यूशनल सम्पत्ति

रु. 60.00 लाख

रु. 6.00 लाख

खता नं. 274, खसरा नं. 615, 619, 621 तथा 635 (156, 156/2 को जगह), कुलीचनगर, परगणा-डासन, हापुड़, उ.प्र., प्लॉट परिया माप 2740 वर्ग मी. में इंस्टीट्यूशनल सम्पत्ति

रु. 237.00 लाख

रु. 23.70 लाख

खता नं. 94, खसरा नं. 605, ग्राम छजारासी, कुलीचनगर, परगणा-डासन, हापुड़, उ.प्र., प्लॉट परिया माप 7240 वर्ग मी. में इंस्टीट्यूशनल सम्पत्ति

रु. 634.00 लाख

रु. 63.40 लाख

जात अधिभारों, बाँद काँइ हा, के साथ अचल सम्पत्ति का विवरण:

- खसरा नं. 636, 637, 638, प्लॉट एरिया-519 वर्ग मी.
- खसरा नं. 636, 637, 638, प्लॉट एरिया-1038 वर्ग मी.
- खसरा नं. 615, 619, 621, 635 (156 एवं 156/2 की जगह) प्लॉट एरिया-2740 वर्ग मी.
- खसरा नं. 605, प्लॉट एरिया-7240 वर्ग मी.

बिना के विस्तृत नियमों एवं शर्तों के लिये कृपया वेबसाइट: [www.mstccommer.com/auctionhome/ibapi/index.jsp](http://www.mstccommer.com/auctionhome/ibapi/index.jsp) में दी गई लिंक देखें।  
तिथि: 21.03.2023 प्राधिकृत अधिकारी, यूको बैंक  
स्थान: नई दिल्ली परिसम्पत्ति प्रबंध शाखा, नई दिल्ली

**NORTH EASTERN CARRYING CORPORATION LIMITED**  
Regd. Office: 9062/47, Ram Bagh Road, Azad Market, Delhi-110006  
Tel. No:- 011-23517519, Email: id-cse@necorpor.com, Website: [www.necorpor.com](http://www.necorpor.com)

**NOTICE OF EXTRAORDINARY GENERAL MEETING & E-VOTING INFORMATION**

Notice is hereby given that the 1/2023-2024 EGM (Extra-ordinary General Meeting) of the Company is scheduled to be held on Tuesday, 18th April, 2023 at 12:00 Noon through Video Conference or Other Audio-Visual Means (OAVM). In compliance with general circular dated December 28, 2022 read with circulars dated April 8, 2020, April 13, 2020, May 5, 2020, January 13, 2021, December 8, 2021, December 14, 2021 & May 5, 2022 and all other applicable laws and circulars issued by the Ministry of Corporate Affairs (MCA), Government of India and Securities and Exchange Board of India (SEBI), to transact the Special Business as set out in the Notice.

As per aforesaid circulars, the Notice of EGM has to be sent only by electronic mode to those Members whose E-mail ID is already registered with the Company's Depositories. The Company is also providing e-voting and remote e-voting facility to all its Members similar to earlier practices.

If your email ID is already registered with the Company's Depository, Notice of EGM and login details for e-voting shall be sent to your registered email address. In case you have not registered your email ID with the Company's Depository, please follow below instructions to register your email ID for obtaining login details for e-voting.

Physical Holding	Send a request to Registrar and Share Transfer Agent of the Company, MAS Services Limited at <a href="mailto:investor@masserv.com">investor@masserv.com</a> providing Front name, Name of the shareholder, scanned copy of the share certificate (Front and Back), PAN (self-attested scanned copy of PAN Card),AADHAR (self-attested scanned copy of Aadhar Card) for registering email address. Please send your bank detail with original cancelled cheque to our RTA (i.e. MAS Services Limited, T-34, 2nd/Floor, Okhla Industrial Area, Phase-II, New Delhi 110020 along with letter mentioning folio no., if not registered already.)
Demat Holding	Please contact your Depository Participant (DP) and register your email address as per the process advised by DP. Please also update your bank detail with your DP for dividend payment by NACH if declare by company.

The Notice of EGM will also be available on Company's website at [www.necorpor.com](http://www.necorpor.com) and also on the Stock Exchanges websites at [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com). Members attending the meeting through VC/ OAVM shall be counted for the purpose of Quorum under Section 103 of the Companies Act, 2013.

For North Eastern Carrying Corporation Limited Sd/-(Sunil Kumar Jain) Chairman & Managing Director DIN: 00010695

**SHREE RAMA MULTI-TECH LIMITED**  
Corporate Identification Number: L25200GJ1993PLC020880

Our Company was incorporated as 'Shree Rama Multi-Tech Limited' on December 17, 1993, as a public limited company under the Companies Act, 1956, pursuant to a certificate of incorporation issued by the Registrar of Companies, Gujarat, Dadra & Nagar Haveli (the "RoC") upon conversion of a partnership firm named "M/s Shree Rama Tool Works". Our Company received its certificate of commencement of business dated January 11, 1994 from the RoC. For details of change in the address of the registered office our Company, see "General Information" on page 41 of the Draft Letter of Offer dated March 22, 2023 ("DLOF").

Registered Office: 18, Corporate House, Opp, Dinesh Hall, Navrangpura, Ahmedabad - 380 009, Gujarat, India  
Telephone: +91 79 2754 6800/900 | Email: [cslegal@srml.com](mailto:cslegal@srml.com)  
Contact Person: Sandip Mistry, Company Secretary and Compliance Officer  
Email: [cslegal@srml.com](mailto:cslegal@srml.com) | Website: [www.srml.com](http://www.srml.com)

**PUBLIC ANNOUNCEMENT**  
(This is a public announcement for information purposes only and is not an offer document and does not constitute an invitation or offer to acquire, purchase or subscribe to securities. Not for release, publication or distribution directly or indirectly outside India.)

**SHREE RAMA MULTI-TECH LIMITED**  
Corporate Identification Number: L25200GJ1993PLC020880

Our Company was incorporated as 'Shree Rama Multi-Tech Limited' on December 17, 1993, as a public limited company under the Companies Act, 1956, pursuant to a certificate of incorporation issued by the Registrar of Companies, Gujarat, Dadra & Nagar Haveli (the "RoC") upon conversion of a partnership firm named "M/s Shree Rama Tool Works". Our Company received its certificate of commencement of business dated January 11, 1994 from the RoC. For details of change in the address of the registered office our Company, see "General Information" on page 41 of the Draft Letter of Offer dated March 22, 2023 ("DLOF").

Registered Office: 18, Corporate House, Opp, Dinesh Hall, Navrangpura, Ahmedabad - 380 009, Gujarat, India  
Telephone: +91 79 2754 6800/900 | Email: [cslegal@srml.com](mailto:cslegal@srml.com)  
Contact Person: Sandip Mistry, Company Secretary and Compliance Officer  
Email: [cslegal@srml.com](mailto:cslegal@srml.com) | Website: [www.srml.com](http://www.srml.com)

**OUR PROMOTERS: NIRMA CHEMICAL WORKS PRIVATE LIMITED AND NIRMA INDUSTRIES PRIVATE LIMITED**

ISSUE OF UP TO 10% EQUITY SHARES WITH A FACE VALUE OF ₹ 5 EACH ("RIGHTS EQUITY SHARES") OF SHREE RAMA MULTI-TECH LIMITED (THE "COMPANY" OR THE "ISSUER") FOR CASH AT A PRICE OF ₹ 100] EACH INCLUDING A SHARE PREMIUM OF ₹ 10] PER RIGHTS EQUITY SHARE ("ISSUE PRICE") FOR AN AGGREGATE AMOUNT UPTO ₹ 7,50,00,000 LAKHS ON A RIGHTS BASIS TO THE ELIGIBLE EQUITY SHAREHOLDERS OF OUR COMPANY IN THE RATIO OF 10] RIGHTS EQUITY SHARE(S) FOR EVERY 10] FULLY PAID-UP EQUITY SHARE(S) HELD BY THE ELIGIBLE EQUITY SHAREHOLDERS ON THE RECORD DATE, THAT IS ON 01] (THE "ISSUE"). THE ISSUE PRICE FOR THE RIGHTS EQUITY SHARES IS 10] TIMES THE FACE VALUE OF THE EQUITY SHARES. FOR FURTHER DETAILS, SEE "TERMS OF THE ISSUE" ON PAGE 187 OF THE DRAFT LETTER OF OFFER.

This public announcement is being made pursuant to Regulation 72(2) of the Securities and Exchange Board of India (Issue of Capital and Disclosure Requirements) Regulations, 2018 as amended (the "SEBI ICDR Regulations"), to inform the public that our Company is proposing, subject to receipt of requisite approvals, market conditions and other considerations, an issue of Equity Shares to eligible equity shareholders on rights basis.

Pursuant to Regulation 72(1) of the SEBI ICDR Regulations, the Company has filed the DLoF with Securities and Exchange Board of India ("SEBI"), SE Limited ("BSE") and National Stock Exchange of India Limited ("NSE") ("BSE" and "NSE", collectively, referred as "Stock Exchanges") on March 23, 2023 and is open to public for comments, if any, for a period of 21 (twenty one) days from the date of such filing. The DLoF is hosted on the website of the SEBI [www.sebi.gov.in](http://www.sebi.gov.in), website of designated stock exchange, i.e., BSE at [www.bseindia.com](http://www.bseindia.com), website of NSE at [www.nseindia.com](http://www.nseindia.com), and website of the Lead Manager i.e. Vivro Financial Services Private Limited at [www.vivro.net](http://www.vivro.net). We invite the public to give comments on the DLoF filed with the SEBI. The public are requested to send a copy of their comments to SEBI, the Company Secretary and Compliance Officer and/or the Lead Manager at their respective addresses on or before 5.00 p.m. on the 21<sup>st</sup> day from the date of filing the DLoF with the SEBI.

Investment in equity and equity related securities involve a degree of risk and investors should not invest any funds in this issue unless they can afford to take the risk with such investment. Investors are advised to read the risk factors carefully before taking an investment decision in this issue. For taking an investment decision, investors must rely on their own examination of our Company and the Issue including the risks involved. The Rights Equity Shares have not been recommended or approved by the SEBI nor does SEBI guarantee the accuracy or adequacy of the contents of this DLoF. Specific attention of investors is invited to the statement of "Risk Factors" on page 18 of the DLoF.

For details of the share capital and capital structure of the Company, see "Capital Structure" on page 46 of the DLoF. The liability of the members of the Company is limited.

The existing Equity Shares are listed on the BSE and the NSE.

Note: Capitalised terms used herein and not specifically defined shall have the same meaning as ascribed to them in the DLoF.

**SHREE RAMA MULTI-TECH LIMITED**  
Corporate Identification Number: L25200GJ1993PLC020880

Our Company was incorporated as 'Shree Rama Multi-Tech Limited' on December 17, 1993, as a public limited company under the Companies Act, 1956, pursuant to a certificate of incorporation issued by the Registrar of Companies, Gujarat, Dadra & Nagar Haveli (the "RoC") upon conversion of a partnership firm named "M/s Shree Rama Tool Works". Our Company received its certificate of commencement of business dated January 11, 1994 from the RoC. For details of change in the address of the registered office our Company, see "General Information" on page 41 of the Draft Letter of Offer dated March 22, 2023 ("DLOF").

Registered Office: 18, Corporate House, Opp, Dinesh Hall, Navrangpura, Ahmedabad - 380 009, Gujarat, India  
Telephone: +91 79 2754 6800/900 | Email: [cslegal@srml.com](mailto:cslegal@srml.com)  
Contact Person: Sandip Mistry, Company Secretary and Compliance Officer  
Email: [cslegal@srml.com](mailto:cslegal@srml.com) | Website: [www.srml.com](http://www.srml.com)

**PUBLIC ANNOUNCEMENT**  
(This is a public announcement for information purposes only and is not an offer document and does not constitute an invitation or offer to acquire, purchase or subscribe to securities. Not for release, publication or distribution directly or indirectly outside India.)

**SHREE RAMA MULTI-TECH LIMITED**  
Corporate Identification Number: L25200GJ1993PLC020880

Our Company was incorporated as 'Shree Rama Multi-Tech Limited' on December 17, 1993, as a public limited company under the Companies Act, 1956, pursuant to a certificate of incorporation issued by the Registrar of Companies, Gujarat, Dadra & Nagar Haveli (the "RoC") upon conversion of a partnership firm named "M/s Shree Rama Tool Works". Our Company received its certificate of commencement of business dated January 11, 1994 from the RoC. For details of change in the address of the registered office our Company, see "General Information" on page 41 of the Draft Letter of Offer dated March 22, 2023 ("DLOF").

Registered Office: 18, Corporate House, Opp, Dinesh Hall, Navrangpura, Ahmedabad - 380 009, Gujarat, India  
Telephone: +91 79 2754 6800/900 | Email: [cslegal@srml.com](mailto:cslegal@srml.com)  
Contact Person: Sandip Mistry, Company Secretary and Compliance Officer  
Email: [cslegal@srml.com](mailto:cslegal@srml.com) | Website: [www.srml.com](http://www.srml.com)

**OUR PROMOTERS: NIRMA CHEMICAL WORKS PRIVATE LIMITED AND NIRMA INDUSTRIES PRIVATE LIMITED**

ISSUE OF UP TO 10% EQUITY SHARES WITH A FACE VALUE OF ₹ 5 EACH ("RIGHTS EQUITY SHARES") OF SHREE RAMA MULTI-TECH LIMITED (THE "COMPANY" OR THE "ISSUER") FOR CASH AT A PRICE OF ₹ 100] EACH INCLUDING A SHARE PREMIUM OF ₹ 10] PER RIGHTS EQUITY SHARE ("ISSUE PRICE") FOR AN AGGREGATE AMOUNT UPTO ₹ 7,50,00,000 LAKHS ON A RIGHTS BASIS TO THE ELIGIBLE EQUITY SHAREHOLDERS OF OUR COMPANY IN THE RATIO OF 10] RIGHTS EQUITY SHARE(S) FOR EVERY 10] FULLY PAID-UP EQUITY SHARE(S) HELD BY THE ELIGIBLE EQUITY SHAREHOLDERS ON THE RECORD DATE, THAT IS ON 01] (THE "ISSUE"). THE ISSUE PRICE FOR THE RIGHTS EQUITY SHARES IS 10] TIMES THE FACE VALUE OF THE EQUITY SHARES. FOR FURTHER DETAILS, SEE "TERMS OF THE ISSUE" ON PAGE 187 OF THE DRAFT LETTER OF OFFER.

This public announcement is being made pursuant to Regulation 72(2) of the Securities and Exchange Board of India (Issue of Capital and Disclosure Requirements) Regulations, 2018 as amended (the "SEBI ICDR Regulations"), to inform the public that our Company is proposing, subject to receipt of requisite approvals, market conditions and other considerations, an issue of Equity Shares to eligible equity shareholders on rights basis.

Pursuant to Regulation 72(1) of the SEBI ICDR Regulations, the Company has filed the DLoF with Securities and Exchange Board of India ("SEBI"), SE Limited ("BSE") and National Stock Exchange of India Limited ("NSE") ("BSE" and "NSE", collectively, referred as "Stock Exchanges") on March 23, 2023 and is open to public for comments, if any, for a period of 21 (twenty one) days from the date of such filing. The DLoF is hosted on the website of the SEBI [www.sebi.gov.in](http://www.sebi.gov.in), website of designated stock exchange, i.e., BSE at [www.bseindia.com](http://www.bseindia.com), website of NSE at [www.nseindia.com](http://www.nseindia.com), and website of the Lead Manager i.e. Vivro Financial Services Private Limited at [www.vivro.net](http://www.vivro.net). We invite the public to give comments on the DLoF filed with the SEBI. The public are requested to send a copy of their comments to SEBI, the Company Secretary and Compliance Officer and/or the Lead Manager at their respective addresses on or before 5.00 p.m. on the 21<sup>st</sup> day from the date of filing the DLoF with the SEBI.

Investment in equity and equity related securities involve a degree of risk and investors should not invest any funds in this issue unless they can afford to take the risk with such investment. Investors are advised to read the risk factors carefully before taking an investment decision in this issue. For taking an investment decision, investors must rely on their own examination of our Company and the Issue including the risks involved. The Rights Equity Shares have not been recommended or approved by the SEBI nor does SEBI guarantee the accuracy or adequacy of the contents of this DLoF. Specific attention of investors is invited to the statement of "Risk Factors" on page 18 of the DLoF.

For details of the share capital and capital structure of the Company, see "Capital Structure" on page 46 of the DLoF. The liability of the members of the Company is limited.

The existing Equity Shares are listed on the BSE and the NSE.

Note: Capitalised terms used herein and not specifically defined shall have the same meaning as ascribed to them in the DLoF.

**LEAD MANAGER TO THE ISSUE**  
**REGISTAR TO THE ISSUE**

**VIVRO**  
Vivro Financial Services Private Limited  
Vivro House, 11, Shashi Colony, Opposite Suvidha Shopping Centre, Paldi, Ahmedabad - 380 007, Gujarat, India.  
Telephone: +91 79 404 2422  
E-mail: [investors@vivro.net](mailto:investors@vivro.net)  
Website: [www.vivro.net](http://www.vivro.net)  
Investor grievance E-mail: [investors@vivro.net](mailto:investors@vivro.net)  
Contact Person: Samir Santara / Kruti Saraiya  
SEBI Registration No.: INM000010122

**KFIN Technologies Limited**  
(Formerly known as KFin Technologies Private Limited)  
Selenium Tower - B, Plot 31 & 32, Gachholiwadi, Financial District, Nanakramguda, Serlingampally, Hyderabad 500 032, Telangana, India.  
Telephone: +91 40 6716 2222  
E-mail: [srml.rits@kfintech.com](mailto:srml.rits@kfintech.com)  
Website: [www.kfintech.com](http://www.kfintech.com)  
Investor grievance E-mail: [einward.ris@kfintech.com](mailto:einward.ris@kfintech.com)  
Contact Person: M. Murali Krishna  
SEBI Registration No.: INFRO0000221

For and on behalf of  
**SHREE RAMA MULTI-TECH LIMITED**  
Sd/-  
Sandip Mistry  
Company Secretary and Compliance Officer

Place: Ahmedabad  
Date: March 23, 2023

**Disclaimer:** Shree Rama Multi-Tech Limited is proposing, subject to receipt of requisite approvals, market conditions and other considerations, a rights issue of its equity shares and has filed a DLoF with SEBI. The DLoF is available on the websites of SEBI and Vivro Financial Services Private Limited at [www.sebi.gov.in](http://www.sebi.gov.in) and [www.vivro.net](http://www.vivro.net), respectively. Investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to the same, please refer to the RHP including the section titled "Risk Factors" on page 18 of the DLoF.

Raka

**सार्वजनिक सूचना (खोया/पाया)**

एराद्वारा इसके द्वारा यह सूचित किया जाता है कि संघित के कारजात एक्सआईआई शाखा संकरदर्जन एक्सरेड (कोड 13182), नई दिल्ली-110029 के पास बंधक के मूल ऋण खाता संख्या 38890810616 के माध्यम से बैंक के पास रकम ग्रे/शे/नीं मिल रहे हैं/युग वसतवेज का विवरण निम्नानुसार है: (1) मूल आवदन ऋण दिनांक 17.11.2012 सर्वत अज्ञात रिपलक सिमिटेड द्वारा श्री नील कुमार गुप्ता और श्रीमती सारिका गुप्ता के जो बतः- मुद्रि/पैड नंबर ए-302, तीसरी मील, टावर-ए, अजंनारा तें गार्डन, प्लॉट नंबर जीएन-02, सेक्टर-16, गेट नोडाला, लिता गौतम बुद्ध नगर, उत्तर प्रदेश में संग्रहित के संबंध में (2) मूल तिथियाय उप-पाया विलेख दिनांक 15.09.2018 ग्रेटर नोडाला प्राधिकरण द्वारा निष्पादित - पट्टादाता/ग्राम पत्र, मेसर्स अजंनारा रिपलक सिमिटेड अपने अधिकृत अधिकारी श्री राजदीप सनसने के माध्यम से द्वितीय सह द्वारा श्री नील कुमार गुप्ता और श्रीमती सारिका गुप्ता के पास में मुद्रि/पैड नंबर ए-302, तीसरी मील, टावर -ए, अजंनारा तें गार्डन, प्लॉट नंबर जीएन 02, सेक्टर-16, गेट नोडाला, लिता गौतम बुद्ध नगर, उत्तर प्रदेश, द्वारा भविष्यत प्रवीकृत संख्या 31771, पुरलक संख्या 1, संशुद्ध सं. 29513, पृष्ठ 279-322, दिनांक 01.09.2018 मुद्र रूप से पता लगाने योग्य नहीं है और साथ ही गारंज होने के रूप में सूचित किया गया है। उपरोक्त मूल वसतवेज जो ग्रे/शे/ बैंक द्वारा पना नहीं लगाए जा सकते हैं और सभी गैरि प्रमातों के बावजूद इसे नहीं मिला है। एक ऑनलाइन मुसुदकी की शिक्षात (एसीआर/एआर दिल्ली पुलिस, पीएल अवररत शाखा के साथ एआर नंबर 269727/2023, दिनांक 22.03.2013 के तहत दर्ज की गई है। यदि किसी को उपरोक्त सभी या कोई उपरोक्त मिलते हैं, तो कृपया तुरंत सूचित करें/उपयुक्त पते पर अधोस्थास्री को बारा करें। किसी भी या सभी उक्त दस्तावेज का कोई भी दुरायोग कार्नु के मौजूद प्रमातों में तहत मुसुदका बलाने के लिए उत्तरदायी होगा।

मुख्य प्रबंधक,  
भाटीय स्टेट बैंक  
शाखा: संकरदर्जन एक्वेवर, नई दिल्ली-110029, ईमेल आईडी: [sbi.13182@sbicoin.in](mailto:sbi.13182@sbicoin.in)

**प्रीसोर्ट हारासिंग फाइनंस (इंडिया) लिमिटेड**  
(पूर्व में एरवीए उपरोक्त हारासिंग फाइनंस (इंडिया) लिमिटेड के रूप में अभिज्ञत)  
नी. कार्यालय 107, प्रथम तल, सेक्टर 29/आई टॉवर, मेराजी सुभाष प्लेस, पीएमएनए नई दिल्ली-110034  
शाखा कार्यालय: 48, उद्योग विहार क्षेत्र 4, पुरवण, हरियाणा 122015

परिशिष्ट-IV [नियम 8(1) देवी]  
अभिप्रेत सूचना  
(अचल सम्पत्ति हेतु)

जम्बई, अधोस्थासत्री ने पीएमबी हारासिंग फाइनंस (इंडिया) लिमिटेड (सिगआईन नं. 7999999030120213परिशिष्ट255432) के प्राधिकृत अधिकारी के रूप में विशिष्ट परिसंस्थितियों के प्रतिनिधित्व एवं प्रतिनिधित्व का प्रतिक्रिया हेतु प्रमाणित किया है। कार्यालय 107, प्रथम तल, सेक्टर 29/आई टॉवर, मेराजी सुभाष प्लेस, पीएमएनए नई दिल्ली-110034 के माध्यम से, 09.01.2023 के अंतर्गत प्रमाणित कर के माध्यम से, स्वतः शाखा नं. LNN5P04117&L800032110 हेतु एक मूल सूचना दिनांकित 09.01.2023 दिनांक की थी, जिसमें चारकासती/सुभित्तु कुमार तथा करुणा दा के सूचना में अति, 09.01.2023 के अनुसार, रु. 12,04,217/- (दश लाख मात्र खर हजार दो सौ सत्तह मात्र) की एक राशि और इस राशि पर ब्याज का, उक्त सूचना की प्राप्ति की तिथि से 60 दिनों के अंतर्गत, प्रतिमुपान करने को कहा गया था। चारकासती/सुभित्तु कुमार नाम का प्रतिमुपान करने में विफल हो चुके हैं, अतः एराद्वारा चारकासती/सुभित्तु तथा जनसाधारण को सूचित किया जाता है कि अधोस्थासत्री ने, यहां इस्तेमाल निम्न विवरणित संपत्ति का प्राधिकृत हित (पार्षद) निदेशित 2002 के नियम 8 के साथ पठित उक्त अधिनियम की धारा 13 की उपा-पारा (ग) के अंतर्गत उक्त प्रस्तावित शक्तियों के प्रयोग/निर्वाह, 21.03.2023 को नीतिक अधिग्रहण कर लिया है। चारकासती को बिना रूप में तथा जनसाधारण को एराद्वारा सामान्य रूप में साक्षात्कृत किया जाता है कि सम्पत्ति का लेन-देन न करे तथा संपत्ति का कोई न किसी भी प्रकार का लेन-देन, 09.01.2023 के अनुसार, रु. 12,04,217/- (दश लाख मात्र खर हजार दो सौ सत्तह मात्र) की एक राशि तथा इस राशि पर ब्याज हेतु उपरोक्त हारासिंग फाइनंस (इंडिया) लिमिटेड के आवासीय होगा। चारकासती को सूचित किया जाता है कि अधोस्थासत्री ने, यहां इस्तेमाल निम्न विवरणित संपत्ति का प्राधिकृत हित (पार्षद) निदेशित 2002 के नियम 8 के साथ पठित उक्त अधिनियम की धारा 13 की उपा-पारा (ग) के अंतर्गत उक्त प्रस्तावित शक्तियों के प्रयोग/निर्वाह, 21.03.2023 को नीतिक अधिग्रहण कर लिया है। चारकासती को बिना रूप में तथा जनसाधारण को एराद्वारा सामान्य रूप में साक्षात्कृत किया जाता है कि सम्पत्ति का लेन-देन न करे तथा संपत्ति का कोई न किसी भी प्रकार का लेन-देन, 09.01.2023 के अनुसार, रु. 12,04,217/- (दश लाख मात्र खर हजार दो सौ सत्तह मात्र) की एक राशि तथा इस राशि पर ब्याज हेतु उपरोक्त हारासिंग फाइनंस (इंडिया) लिमिटेड के आवासीय होगा। चारकासती को सूचित किया जाता है कि अधोस्थासत्री ने, यहां इस्तेमाल निम्न विवरणित संपत्ति का प्राधिकृत हित (पार्षद) निदेशित 2002 के नियम 8 के साथ पठित उक्त अधिनियम की धारा 13 की उपा-पारा (ग) के अंतर्गत उक्त प्रस्तावित शक्तियों के प्रयोग/निर्वाह, 21.03.2023 को नीतिक अधिग्रहण कर लिया है। चारकासती को बिना रूप में तथा जनसाधारण को एराद्वारा सामान्य रूप में साक्षात्कृत किया जाता है कि सम्पत्ति का लेन-देन न करे तथा संपत्ति का कोई न किसी भी प्रकार का लेन-देन, 09.01.2023 के अनुसार, रु. 12,04,217/- (दश लाख मात्र खर हजार दो सौ सत्तह मात्र) की एक राशि तथा इस राशि पर ब्याज हेतु उपरोक्त हारासिंग फाइनंस (इंडिया) लिमिटेड के आवासीय होगा। चारकासती को सूचित किया जाता है कि अधोस्थासत्री ने, यहां इस्तेमाल निम्न विवरणित संपत्ति का प्राधिकृत हित (पार्षद) निदेशित 2002 के नियम 8 के साथ पठित उक्त अधिनियम की धारा 13 की उपा-पारा (ग) के अंतर्गत उक्त प्रस्तावित शक्तियों के प्रयोग/निर्वाह, 21.03.2023 को नीतिक अधिग्रहण कर लिया है। चारकासती को बिना रूप में तथा जनसाधारण को एराद्वारा सामान्य रूप में साक्षात्कृत किया जाता है कि सम्पत्ति का लेन-देन न करे तथा संपत्ति का कोई न किसी भी प्रकार का लेन-देन, 09.01.2023 के अनुसार, रु. 12,04,217/- (दश लाख मात्र खर हजार दो सौ सत्तह मात्र) की एक राशि तथा इस राशि पर ब्याज हेतु उपरोक्त हारासिंग फाइनंस (इंडिया) लिमिटेड के आवासीय होगा। चारकासती को सूचित किया जाता है कि अधोस्थासत्री ने, यहां इस्तेमाल निम्न विवरणित संपत्ति का प्राधिकृत हित (पार्षद) निदेशित 2002 के नियम 8 के साथ पठित उक्त अधिनियम की धारा 13 की उपा-पारा (ग) के अंतर्गत उक्त प्रस्तावित शक्तियों के प्रयोग/निर्वाह, 21.03.2023 को नीतिक अधिग्रहण कर लिया है। चारकासती को बिना रूप में तथा जनसाधारण को एराद्वारा सामान्य रूप में साक्षात्कृत किया जाता है कि सम्पत्ति का लेन-देन न करे तथा संपत्ति का कोई न किसी भी प्रकार का लेन-देन, 09.01.2023 के अनुसार, रु. 12,04,217/- (दश लाख मात्र खर हजार दो सौ सत्तह मात्र) की एक राशि तथा इस राशि पर ब्याज हेतु उपरोक्त हारासिंग फाइनंस (इंडिया) लिमिटेड के आवासीय होगा। चारकासती को सूचित किया जाता है कि अधोस्थासत्री ने, यहां इस्तेमाल निम्न विवरणित संपत्ति का प्राधिकृत हित (पार्षद) निदेशित 2002 के नियम 8 के साथ पठित उक्त अधिनियम की धारा 13 की उपा-पारा (ग) के अंतर्गत उक्त प्रस्तावित शक्तियों के प्रयोग/निर्वाह, 21.03.2023 को नीतिक अधिग्रहण कर लिया है। चारकासती को बिना रूप में तथा जनसाधारण को एराद्वारा सामान्य रूप में साक्षात्कृत किया जाता है कि सम्पत्ति का लेन-देन न करे तथा संपत्ति का कोई न किसी भी प्रकार का लेन-देन, 09.01.2023 के अनुसार, रु. 12,04,217/- (दश लाख मात्र खर हजार दो सौ सत्तह मात्र) की एक राशि तथा इस राशि पर ब्याज हेतु उपरोक्त हारासिंग फाइनंस (इंडिया) लिमिटेड के आवासीय होगा। चारकासती को सूचित किया जाता है कि अधोस्थासत्री ने, यहां इस्तेमाल निम्न विवरणित संपत्ति का प्राधिकृत हित (पार्षद) निदेशित 2002 के नियम 8 के साथ पठित उक्त अधिनियम की धारा 13 की उपा-पारा (ग) के अंतर्गत उक्त प्रस्तावित शक्तियों के प्रयोग/निर्वाह, 21.03.2023 को नीतिक अधिग्रहण कर लिया है। चारकासती को बिना रूप में तथा जनसाधारण को एराद्वारा सामान्य रूप में साक्षात्कृत किया जाता है कि सम्पत्ति का लेन-देन न करे तथा संपत्ति का कोई न किसी भी प्रकार का लेन-देन, 09.01.2023 के अनुसार, रु. 12,04,217/- (दश लाख मात्र खर हजार दो सौ सत्तह मात्र) की एक राशि तथा इस राशि पर ब्याज हेतु उपरोक्त हारासिंग फाइनंस (इंडिया) लिमिटेड के आवासीय होगा। चारकासती को सूचित किया जाता है कि अधोस्थासत्री ने, यहां इस्तेमाल निम्न विवरणित संपत्ति का प्राधिकृत हित (पार्षद) निदेशित 2002 के नियम 8 के साथ पठित उक्त अधिनियम की धारा 13 की उपा-पारा (ग) के अंतर्गत उक्त प्रस्तावित शक्तियों के प्रयोग/निर्वाह, 21.03.2023 को नीतिक अधिग्रहण कर लिया है। चारकासती को बिना रूप में तथा जनसाधारण को एराद्वारा सामान्य रूप में साक्षात्कृत किया जाता है कि सम्पत्ति का लेन-देन न करे तथा संपत्ति का कोई न किसी भी प्रकार का लेन-देन, 09.01.2023 के अनुसार, रु. 12,04,217/- (दश लाख मात्र खर हजार दो सौ सत्तह मात्र) की एक राशि तथा इस राशि पर ब्याज हेतु उपरोक्त हारासिंग फाइनंस (इंडिया) लिमिटेड के आवासीय होगा। चारकासती को सूचित किया जाता है कि अधोस्थासत्री ने, यहां इस्तेमाल निम्न विवरणित संपत्ति का प्राधिकृत हित (पार्षद) निदेशित 2002 के नियम 8 के साथ पठित उक्त अधिनियम की धारा 13 की उपा-पारा (ग) के अंतर्गत उक्त प्रस्तावित शक्तियों के प्रयोग/निर्वाह, 21.03.2023 को नीतिक अधिग्रहण कर लिया है। चारकासती को बिना रूप में तथा जनसाधारण को एराद्वारा सामान्य रूप में साक्षात्कृत किया जाता है कि सम्पत्ति का लेन-देन न करे तथा संपत्ति का कोई न किसी भी प्रकार का लेन-देन, 09.01.2023 के अनुसार, रु. 12,04,217/- (दश लाख मात्र खर हजार दो सौ सत्तह मात्र) की एक राशि तथा इस राशि पर ब्याज हेतु उपरोक्त हारासिंग फाइनंस (इंडिया) लिमिटेड के आवासीय होगा। चारकासती को सूचित किया जाता है कि अधोस्थासत्री ने, यहां इस्तेमाल निम्न विवरणित संपत्ति का प्राधिकृत हित (पार्षद) निदेशित 2002 के नियम 8 के साथ पठित उक्त अधिनियम की धारा 13 की उपा-पारा (ग) के अंतर्गत उक्त प्रस्तावित शक्तियों के प्रयोग/निर्वाह, 21.03.2023 को नीतिक अधिग्रहण कर लिया है। चारकासती को बिना रूप में तथा जनसाधारण को एराद्वारा सामान्य रूप में साक्षात्कृत किया जाता है कि सम्पत्ति का लेन-देन न करे तथा संपत्ति का कोई न किसी भी प्रकार का लेन-देन, 09.01.2023 के अनुसार, रु. 12,04,217/- (दश लाख मात्र खर हजार दो सौ सत्तह मात्र) की एक राशि तथा इस राशि पर ब

